



# ગુજરાત જાહેર સેવા આયોગ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક. ૨૩/૨૦૨૧-૨૨ થી જા.ક. ૩૦/૨૦૨૧-૨૦૨૨ માટે તારીખ-૨૮/૦૯/૨૦૨૧ (૧૩:૦૦ કલાક) થી તારીખ-૧૩/૧૦/૨૦૨૧ (૧૩:૦૦ કલાક) સુધી Online અરજીઓ મંગાવવામાં આવે છે. (જેમાં જાહેરાત ક્રમાંક ૨૩/૨૦૨૧-૨૨ અને ૨૪/૨૦૨૧-૨૨ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની છે. સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ, અરજી ફી ઓનલાઇન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તથા અન્ય વિગતો આયોગના નોટીસ બોર્ડ ઉપર અથવા આયોગની વેબસાઇટ <https://gpsc.gujarat.gov.in> અને <https://gpsc-ojas.gujarat.gov.in> ઉપર જોવા વિનંતી છે. જાહેરાતની બધીજ-સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોવા બાદ જ ઉમેદવારે <https://gpsc-ojas.gujarat.gov.in> પર Online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

જાહેરાત ક્રમાંક	જગ્યાનું નામ	કુલ જગ્યાઓ	કક્ષાવાર જગ્યાઓ					કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ					કુલ જગ્યાઓ પૈકી શારીરિક અશક્તતા (દિવ્યાંગો) માટે અનામત	કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે અનામત	પ્રાથમિક/મુખ્ય કસોટીની સ્થિતિ તારીખ	પ્રાથમિક/મુખ્ય કસોટીના પરિણામનો સંભવિત માસ	રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ	શૈક્ષણિક લાયકાત (દેકમાં)	અનુભવ (દેકમાં)
			બિન અનામત	આ.ન.વ. (EWS)	સા.શૈ.પ. વર્ગ	અનુ. જાતિ	અનુ. જનજાતિ	બિન અનામત	આ.ન.વ. (EWS)	સા.શૈ.પ. વર્ગ	અનુ. જાતિ	અનુ. જનજાતિ							
૧	૨	૩	૪					૫					૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨
<b>જાહેરાત ક્રમાંક ૨૩ અને ૨૪/૨૦૨૧-૨૨, ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની છે</b>																			
૨૩	જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-૨ (GMC)	૦૧	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૧૯-૧૨-૨૦૨૧	ફેબ્રુ.-૨૦૨૨	મે-૨૦૨૨	BE-Arch-Civil/PG	૫-વર્ષ
૨૪	પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (GMC)	૦૨	૦૨	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૨-૦૧-૨૦૨૨	ફેબ્રુ.-૨૦૨૨	--	Dip/BE-Arch-Civil	૪૩૨ નથી
૨૫	મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨	૦૬	૦૩	૦૦	૦૨	૦૦	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૧૯-૧૨-૨૦૨૧	ફેબ્રુ.-૨૦૨૨	મે-૨૦૨૨	Dip/Deg. Printing	૨/૪ વર્ષ
૨૬	નાયબ નિયામક, ગુજ. આંકડા. સેવા, વર્ગ-૧	૧૩	૦૫	૦૨	૦૩	૦૧	૦૨	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૧૯-૧૨-૨૦૨૧	ફેબ્રુ.-૨૦૨૨	જૂન-૨૦૨૨	PG/Ph.D.	૨/૫ વર્ષ
૨૭	વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજ. કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨	૦૬	૦૫	૦૦	૦૧	૦૦	૦૦	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૬-૦૧-૨૦૨૨	માર્ચ-૨૦૨૨	જૂન-૨૦૨૨	Graduate	૫-વર્ષ
૨૮	આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-૨	૦૧	૦૦	૦૦	૦૦	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૨-૦૧-૨૦૨૨	ફેબ્રુ.-૨૦૨૨	મે-૨૦૨૨	Graduation/PG	૫-વર્ષ
૨૯	પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ-૨ (ખાસ ભરતી)	૦૩	૦૦	૦૦	૦૦	૦૦	૦૩	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૨-૦૧-૨૦૨૨	ફેબ્રુ.-૨૦૨૨	મે-૨૦૨૨	B.Pharm/Pharm.D etc	૫-વર્ષ
૩૦	<b>ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલકી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨</b>																		
વર્ગ-૧	ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ/નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારી	૧૫	૦૮	૦૧	૦૩	૦૧	૦૨	૦૩	૦૦	૦૧	૦૦	૦૦	૦૧	૦૧	પ્રાથમિક કસોટી ૧૨-૧૨-૨૦૨૧	પ્રાથમિક કસોટીનું પરીણામ જાન્યુઆરી-૨૨	--	સ્નાતક	--
	નાયબ પોલીસ અધિકારી	૦૮	૦૪	૦૦	૦૩	૦૦	૦૧	૦૧	૦૦	૦૧	૦૦	૦૦	૦૦						
	જિલ્લા/નાયબ રજિસ્ટ્રાર	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦						
	સહાયક રાજ્ય વેરા કમિશનર	૪૮	૨૦	૦૪	૧૨	૦૩	૦૭	૦૭	૦૧	૦૩	૦૦	૦૨	૦૨						
વર્ગ-૨	નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)	૦૧	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	મુખ્ય લેખિત પરીક્ષાની તારીખ તથા પરીણામનો સંભવિત માસ અને રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ હવે પછી જણાવવામાં આવશે.					
	મામલતદાર	૧૨	૦૩	૦૧	૦૮	૦૦	૦૦	૦૧	૦૦	૦૩	૦૦	૦૦	૦૨						
	તાલુકા વિકાસ અધિકારી	૧૦	૦૫	૦૧	૦૩	૦૦	૦૧	૦૨	૦૦	૦૧	૦૦	૦૦	૦૧						
	મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર	૧૦	૦૬	૦૧	૦૨	૦૦	૦૧	૦૨	૦૦	૦૦	૦૦	૦૦	૦૦						
	સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)	૦૧	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦						
સરકારી શ્રમ અધિકારી	૦૨	૦૦	૦૦	૦૨	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦							
રાજ્ય વેરા અધિકારી	૭૫	૨૯	૦૭	૨૦	૦૫	૧૧	૧૦	૦૨	૦૬	૦૨	૦૩	૦૩	૦૦						

નોંધ:- ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના છેલ્લા સમય સુધી "Editable" છે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી. ઓનલાઇન કરેલ અરજીમાં વિગત-માહિતી ભરવામાં કોઈ ભૂલ થાય તો "Edit" વિકલ્પમાં જઈ વિગત સુધારી લેવી. નવી અરજી ન કરવી. અરજી કરતી વખતે અને ત્યારબાદ ઉમેદવારે પોતાની સહી, ફોટો અને અન્ય વિગતો ચકાસી તેની ખરાઈ કરવી, જો ભૂલ હોય તો સુધારો કરી લેવા જણાવવામાં આવે છે. જાહેરાત ઓનલાઇન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં.

- આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોની જગ્યાઓની સંખ્યામાં ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે.
- ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કસોટી OMR - CBRT (Computer Based Recruitment Test) માધ્યમથી લેવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે આયોગની વેબસાઇટ <https://gpsc.gujarat.gov.in> અને <https://gpsc-ojas.gujarat.gov.in> પર પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાત પ્રમાણે રહેશે.
- ઉંચક જાહેરાતો પૈકી જાહેરાત ક્રમાંક: ૨૩ થી ૨૯/૨૦૨૧-૨૨માં (જાહેરાત ક્રમાંક ૨૪/૨૦૨૧-૨૨ સિવાય) પ્રાથમિક કસોટીમાં ૩૦૦ ગુણમાંથી જે ગુણ મેળવેલ હશે તેના ૫૦% ગુણભર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના ૫૦% ગુણભરના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે. એટલે કે, પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ ૩૦૦ અને ૧૦૦માંથી મેળવેલ ગુણનું ૫૦-૫૦ ટકા વેધટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં ૧૦૦ ગુણના ૧૦૦ પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા ૨૦૦ ગુણના ૨૦૦ પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. (સદરહુ જાહેરાતોમાં પ્રાથમિક કસોટીમાં ૧૫૪ થી ઓછા ગુણ મેળવશે તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.)
- જા. ક્રમાંક: ૨૪/૨૦૨૧-૨૨ ની પ્રાથમિક કસોટીની રૂપરેખા: પ્રશ્નપત્ર-૧ સામાન્ય અભ્યાસના ૧૦૦ ગુણના ૧૦૦ પ્રશ્નો, ગુજરાતીના ૫૦ ગુણના ૫૦ પ્રશ્નો અને અંગ્રેજીના ૫૦ ગુણના ૫૦ પ્રશ્નો પ્રશ્નપત્ર-૨ સંબંધિત વિષયના ૨૦૦ ગુણના ૨૦૦ પ્રશ્નો. ઉમેદવારની આખરી પસંદગી હેતુલક્ષી પ્રશ્નપત્ર-૧ ના ૨૦૦ ગુણ અને હેતુલક્ષી પ્રશ્નપત્ર-૨ ના ૨૦૦ ગુણ એમ કુલ ૪૦૦ ગુણમાંથી મેળવેલ કુલ ગુણના આધારે કરવામાં આવશે.) આ જાહેરાતો વર્ગ-૩ની હોઈ રૂબરૂ મુલાકાત યોજવાની થતી નથી.
- જા. ક્ર. ૩૦/૨૦૨૧-૨૨ અન્વયે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને જાહેરાતમાં ભરતી નિયમોમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા કુલ જગ્યાઓના આશરે ૧૫ (પંદર) ગણા ઉમેદવારોને કામચલાઉ ધોરણે મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે અને ત્યારબાદ આયોગે નક્કી કરેલા લાયકી ધોરણમાં આવતા કુલ જગ્યાઓના ૦૩ (ત્રણ) ગણા ઉમેદવારોને રૂબરૂ મુલાકાતમાં બોલાવવામાં આવશે.
- જા.ક્ર.-૨૩/૨૦૨૧-૨૨ અને જા.ક્ર.-૨૪/૨૦૨૧-૨૨ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ના કર્મચારી ગણાશે. તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહીં. સદરહુ જગ્યાઓ માટે સંબંધિત કોર્પોરેશનનાં ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે.
- શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો (દિવ્યાંગ ઉમેદવારો) ની જગ્યામાં સરકારની અદ્યતન સૂચનાઓ મુજબ સુધારો થવાની સંભાવના રહે છે.
- બધી જ જાહેરાતો માટે પસંદગી યાદી મેરીટના આધારે આખરી કરવામાં આવશે. આખરી પરિણામ વખતે જ ઉમેદવારે મેળવેલ આખરી ગુણ જાહેર કરવામાં આવશે.
- (૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઇન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે. (૨) કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ કે ચૂક બાબતે સુધારો કરવાની જરૂરીયાત જણાય તો <https://gpsc-ojas.gujarat.gov.in> ના "Online Application" મેનુમાં "Edit"

વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના છેલ્લા દિવસ-સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે. **જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં.** (૩) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે. (૪) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે.

➤ ઉમરનાં પુરાવા માટે SSC CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. ANNEXURE-'A' (ENGLISH) માન્ય ગણાશે નહીં.

➤ ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે **Online અરજી કરવા માટે તારીખ-૧૩-૧૦-૨૦૨૧ના ૧૩:૦૦ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે** માટે આખરી દિવસો સુધી રાહમાં નહિં રહેતા **Online** અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી **Confirm** કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં **Online** અરજીપત્રક ભરી **Confirmation Number** મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચુક થયેથી તારીખ-૨૧-૦૯-૨૦૨૧ ઉમેદવારે જ જવાબદાર રહેશે.

follow us on:  [@GPSC\\_OFFICIAL](https://twitter.com/GPSC_OFFICIAL)  <https://gpsc.gujarat.gov.in>  [GPSC \(Official\)](#)